



જૂન મહિનાથી એલિંગ હોસ્પિટલમાં બાળકોની સેવાઓમાં ફેરફાર થશે

એલિંગ હોસ્પિટલમાં બાળકોની સેવાઓમાં કેટલાક ફેરફારો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ લીફ્લેટમાં મુખ્ય ફેરફારો વિશે સમજાવવામાં આવ્યું છે પણ 30 જૂન 2016 સુધી કૃપા કરી અગાઉની જેમ સામાન્ય રીતે જ અમારી સેવાઓનો ઉપયોગ કરવાનું ચાલુ રાખો.

એલિંગ હોસ્પિટલમાં કાર્યરત રહેનારી સેવાઓ	એલિંગ હોસ્પિટલમાં શરૂ થનારી નવી સેવાઓ	30 જૂન 2016ના રોજ બંધ થનારી સેવાઓ
<p>તત્કાલ પીડિયાટ્રિક સેવાઅર્બન કેર સેન્ટર દ્વારા ઉપલબ્ધ.</p> <p>બહારના દર્દીઓ માટે સામાન્ય અને પીડિયાટ્રિક સેવાઓ એટલે કે ડાયાબિટીસ અને અસ્થમા માટે હોસ્પિટલ ક્લિનિક્સ તેમજ કોમ્યુનિટી ક્લિનિક્સ.</p> <p>નોન-ઇમર્જન્સી, ઓછી તીવ્રતાવાળી ડે કેર સેવાઓ જેવી કે કેટલીક સર્જરી, માનસિક સ્વાસ્થ્ય અને ફિઝિયોથેરાપી.</p>	<p>કન્સલ્ટન્ટના માર્ગદર્શન હેઠળ પીડિયાટ્રિક રેપિડ એક્સેસ ક્લિનિક જે બાળકોને 48 કલાકની અંદર નિષ્ણાંતને બતાવવાની જરૂર હોય તેમના માટે જીપીને તરત જ નિષ્ણાંતોની ખાસ સલાહ અને સમયસર અપોઇન્ટમેન્ટ્સની વ્યવસ્થા.</p> <p>સાઉથહોલ અને એક્ટનમાં ખાસબાળકો માટે કનેક્ટિંગ કેર ઘરની નજીક સેવા ઉપલબ્ધ, જેથી બાળકોને હોસ્પિટલમાં રહેવાની જરૂરિયાત ઊભી ન થાય.</p> <p>ચિલ્ડ્રન્સ કોમ્યુનિટી નર્સિંગ ટીમ હોસ્પિટલમાં દાખલ થવા અને બાળકો માટે કોમ્યુનિટી કેર માટે એલિંગ હોસ્પિટલમાં આવવું.</p>	<p>દાખલ થયેલા બાળ દર્દીઓ માટેનો વોર્ડ</p> <p>ચાર દૈનિક નિદાન બેડ સહિત, 16 બેડ. હાલ એક સમયે 10થી 12 બાળકોની દર્દીઓ તરીકે સંભાળ લેવાય છે.</p> <p>બાળકો માટે નિષ્ણાંત A&E કેર હવે ઇમર્જન્સી 'ભૂરી લાઇટ'વાળી એમ્બ્યુલેન્સ બાળકોને એલિંગ હોસ્પિટલની A&Eમાં નહીં લઈ જાય.</p> <p>A&Eમાં આવનારા બાળકોનું નિદાન કરવામાં આવશે, સ્થિર કરવામાં આવશે અને જરૂરિયાત મુજબ સુરક્ષિત રીતે બીજે લઈ જવામાં આવશે.</p>

વધુ માહિતી મે મહિનામાં ઉપલબ્ધ થશે અને વધુ જાણકારી માટે, મુલાકાત લો

www.healthiernorthwestlondon.nhs.uk અથવા અમને ફોલો કરો @HealthierNWL પર

એ ભૂલશો નહીં કે માત્ર હોસ્પિટલો જ આરોગ્ય સેવાઓ, ઇલાજ અને સલાહ આપતી નથી.

તમારી એનએચએસ સેવાઓ કેવી રીતે મેળવશો

એનએચએસ 111

જ્યારે પણ તમને સલાહ અથવા આરોગ્ય સેવાઓની જરૂર પડે, પણ જો તે જીવલેણ ન હોય તો અને જો તમને તમારા માનસિક સ્વાસ્થ્ય વિશે ગંભીર ચિંતા હોય તો તમારે 111 પર ફોન કરવો જોઈએ.

દવાઓ

તમારા સ્થાનિક દવા વિકેતા તાલીમબદ્ધ છે અને અને તમને સામાન્ય સમસ્યાઓ જેવી કે માથાનો દુખાવો, પેટની સમસ્યાઓ, ખાંસી અને શરદી માટે ઇલાજ અથવા દવાઓ અને સલાહ આપી શકે છે.

જીપી અને કોમ્યુનિટી સેવાઓ

જીપી અને તેમની ટીમો સમગ્ર પરિવાર માટે શારિરીક અને માનસિક સ્વાસ્થ્ય સેવાઓ આપે છે.

એલિંગ વિસ્તારના જીપી હવે એલિંગ હોસ્પિટલમાં ચિલ્ડ્રન્સ રેપિડ એક્સેસ ક્લિનિકની સેવાઓ મેળવી શકે છે જેમાં જીપીને બાળકોના સ્વાસ્થ્ય માટે નિષ્ણાંતોની સલાહ અને નિષ્ણાંતોની અપોઇન્ટમેન્ટ આપવામાં આવે છે.

તત્કાલ સેવા કેન્દ્રો

એલિંગ હોસ્પિટલમાં દિવસના 24 કલાક, અઠવાડિયાના સાત દિવસ સેવાઓ ઉપલબ્ધ છે જેમાં તત્કાલ પણ જીવનું જોખમ ન હોય તેવી ઇજાઓ જેમ કે નાની વાઢકાપ, હાડકું ભાંગી જવું, ચેપ લાગવો અથવા હાડકું મચકોડાઇ જવું વગેરે માટે સેવાઓનો સમાવેશ થાય છે.

અકસ્માત અને ઇમર્જન્સી (A&E)

A&E મોટી, જીવલેણ બિમારીઓ અને ઇજાઓવાળા લોકો માટે છે. જો તમે A&E માટે ન આવી શકતા હો તો એમ્બ્યુલેન્સ માટે 999 ડાયલ કરો.